

GOPAL SNACKS LIMITED

(Formerly known as Gopal Snacks Private Limited)

Regd. Office/Unit 1 - Plot No. G2322-23-24, GIDC, Metoda,
Tal. - Lodhika, Dist - Rajkot - 360021, (Gujarat), India. Ph : 02827 297060
CIN : U15400GJ2009PLC058781
email : info@gopalsnacks.com | www.gopalnamkeen.com



Ref: **GSL/CS/SE/Q2/2024-25**

Date: **19.07.2024**

BSE Limited

Department of Corporate Services,
Pheroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai – 400001

National Stock Exchange Limited

Exchange Plaza, 5th Floor,
Plot No. C/1, G Block,
Bandra-Kurla Complex, Mumbai – 400051

Script code: **544140**

Symbol: **GOPAL**

Sub: Intimation of Newspaper Publication of the Un-Audited Financial Results of the Company for the quarter ended on 30th June, 2024

Dear Sir / Madam,

Pursuant to the requirements of the Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, the Un-Audited Financial Results of the Company for the quarter ended on 30th June 2024 as approved by the Board of Directors at their meeting held on Thursday, 18th July 2024 is published in “**The Economic Times**” in English language newspaper and in “**Navgujarat Samay**” in Regional language (Gujarati) newspaper on today, Friday, 19th July, 2024. The copies of the newspaper publication are enclosed herewith for your reference.

The above-mentioned newspaper publication will also be available on website of the Company at www.gopalnamkeen.com

Kindly acknowledge and take on your record. Thanking You.

Yours Faithfully,

For, **GOPAL SNACKS LIMITED**

CS Mayur Gangani

Company Secretary and Compliance officer
Membership No. FCS 9980

Encls: a/a

Unit 2 : GS:Survey No. 435/1A, 432, Pawaddauna Road, NH-6, Village-Mouda, Nagpur - 441104, (Maharashtra), India.
Unit 3 : G5:Survey. No. 267, 271, 272, 274, Village: Rahiyol - 383310, Taluka - Dhansura, District - Aravalli, (Gujarat), India.



Two Dead, 20 Injured as 8 Coaches of Chandigarh-Dibrugarh Express Derail

Accident in UP's Gonda leaves 2 seriously injured; rescue ops underway; efforts on to restore traffic

Our Political Bureau

New Delhi: At least two people were killed and 20 injured on Thursday when eight coaches of the Chandigarh-Dibrugarh Express (15904) derailed between Motiganj and Jhilibari railway stations in Uttar Pradesh's (UP)'s Gonda district. The accident occurred around 2:37 pm.

Sources in the UP's Director General of Police's (DGP) office said two persons were killed while two persons have received serious injuries. The administration has deployed its different teams to ensure proper rescue operation at the site, the office said. Technical teams of Indian Railways had also reached the accident site to ascertain the reason behind the derailment.

According to the office of Public Relation Officer or PRO (Eastern Railways, Gorakhpur), relief medical van also reached the accident site. Gonda District Magistrate Neha Sharma, who reached the site, directed the coaches of the train got derailed, adding that the injured were being rushed to hospital and relief operations were on. According to the office of UP's Relief Commissioner, a 40-member medical



The mishap occurred between Motiganj and Jhilibari railway stations on Thursday

team and 30 ambulances were at the spot and more medical teams and ambulances were being rushed. Two teams of state disaster relief force were also pressed into service for expanding rescue and relief operations. Senior railway and local administration officials were at the spot, about 150 km from Lucknow, to oversee the relief work. Chief Public Relations Officer of

SDFR JOINS OPERATIONS
Two teams of state disaster relief force were also pressed into service for expanding rescue and relief operations

north east division Pankaj Singh said that the priority was to complete the rescue operation. "Then, our teams will focus on the restoration of train movement on the tracks," he told ET over the phone. According to him, helpines had been established and several teams of doctors were camping on the spot. "Required medical equipment is also now available on the accident site," Singh said.

Meanwhile, with the help of the state government, Railways has arranged several buses to transport the passengers to Manakpur railway station, which is close to the accident site. Passengers would be sent to their destinations by special trains, Singh said. Several trains had also been diverted to other routes.

Sources also said that there were no clashes among the derailed coaches. The coaches got overturned after the accident. After receiving information about the train accident, UP Chief Minister Yogi Adityanath directed the local administration to help the affected passengers. The CM also asked the officials to ensure proper medical treatment of the passengers injured in the accident.

Over 3 Yrs, Toshiba Transmission to Pump ₹500 cr into Gear Manufacturing

Our Bureau

Mumbai: Toshiba Transmission & Distribution Systems India (TTDI) on Thursday said it will invest ₹500 crore to increase the manufacturing capacity of power and distribution transformers by approximately 1.5 times. This will help the company address the growing global demand for power transmission and distribution equipment. The investment will be made over three years from FY24 to FY26, the company said in a statement.

"Furthering our commitment to Make-in-India and Export-from-India, the new investment will improve operational efficiency, increase speed to market, and support in expanding our business in India and overseas," said Hiroshi Furuta, chairman and managing director, TTDI. Toshiba is a supplier of transmission and distribution (T&D) equipment for both conventional and renewable energy sources. "With India established as a hub for our T&D equipment manufacturing operations and export base, TTDI has supplied India-made transformers to over 50 countries," the company said.

With this investment, TTDI will increase its assembly and test line capacity for distribution transformers and power transformers for the transmission grids and distribution networks. Its enhanced testing capacity for power transformers will represent a significant upgrade in its testing capacity, specifically geared towards expanding exports to power transformers and meeting the high demand for 400kV/765kV transformers in the Indian market.

"Distribution transformer expansion is mainly to create a dedicated state-of-the-art facility for CRGO (cold rolled grain oriented) steel processing centre to enhance the vertical integration facility," the company said. This can help in reducing the process lead time and enhance quality and safety, it said, adding that it will also build a new manufacturing facility for surge arresters.

SEC REGISTRANTS EASY TARGETS: EX-HEAD OF UP'S DEPT OF JUSTICE'S FRAUD SECTION

'Short Seller Reports Rising, Flexible Crisis Plan Critical'

Mohit Bhatta

New Delhi: Indian companies with global operations need to have crisis management plans in place given the rise in the number of short sellers, said William J. Stellmach, former head of the US Department of Justice's Fraud Section. He now works at New York-headquartered law firm Willkie Farr & Gallagher LLP. Stellmach is a partner at the firm's Washington office and leads its global investigations practice, often advising and defending companies featured in short seller reports. "The number of short seller reports is growing. If you are an SEC (Securities and Exchange Commission) registrant and issuing securities to investors in the US, then you are an attractive target. So having a flexible crisis management plan is critical," Stellmach told ET in an exclusive interview. Stellmach was the prosecutor on the trial of fraudster Allen Stanford in the



Short sellers have repeatedly defeated defamation suits in the USA. Another liability is to prove fraud by the short seller
WILLIAM J. STELLMACH
Partner, Willkie Farr & Gallagher LLP

US which led to an unprecedented 110-year prison sentence for perpetrating a \$8 billion investment fraud in 2012. He said it was extremely challenging to sue short sellers in the US and often counterproductive. "Short sellers have repeatedly defeated defamation suits in the USA, which set an extremely high bar. Another liability theory is to prove fraud by the short seller. But short sellers are generally very transparent in their disclaimers that they may have taken a trading position inconsistent with their short report, which means they fully disclose their conflict of interest," he said.

In early 2023, the Adani Group had been the target of a short seller attack by US-based Hindenburg Research. "The best plan is to prevent US regulators from getting involved. Your communication should be targeted to immediate stakeholders. Keep your responses tight and crisp, to no more than three pages. And act within seven to 10 days

Nokia Q2 India Sales Down 66% After Record 2023

Follows Ericsson's poor showing, pins hopes on fresh 5G

Our Bureau

Kolkata: Global networks vendor Nokia's sales in India continued to plunge in the second quarter of the 2024 calendar year, in line with rival Ericsson reporting a similar fall a few days back, with their big telco clients Reliance Jio and Bharti Airtel cutting down on network capex spends. It concluded their pan-India 5G rollouts.

Industry executives and analysts say Finland's Nokia and Sweden's Ericsson will now have to rely on fresh 4G and 5G gear supply deals with Vodafone Idea (VI) to revive their plunging sales in India, and support global growth.

On Thursday, Nokia posted a steep 68% Year-on-Year (YoY) fall in India net sales to ₹4,067 crore in Q2, 2024, while Sweden's Ericsson reported a 44% YoY slide in sales in its Southeast Asia, Oceania and India market to ₹6,093 crore approx in Q2, 2024. Ericsson does not reveal India-specific sales numbers.

In a statement, Nokia chief executive officer (CEO) Pasi Saikku said, "India accounted for three quarters of the Finnish gear

maker's 18% YoY overall sales decline (constant currency) in Q2, 2024. "The most significant impact was the challenging year-over-year comparison period, which saw the peak of India's rapid 5G deployment. India accounts for three quarters of the decline in Nokia's mobile networks business net sales also fell 24% on a constant currency basis, mainly due to the decrease in India's 5G deployment," Ericsson CEO Borje Ekblom expects market conditions remain challenging, as the pace of 5G rollouts in India investments has slowed. "The decline sales was primarily a result of materially lower sales in market areas Southeast Asia, Oceania and India, as investment levels in India have normalised after a peak."

As per data, India remains the second-largest market after the US—for Ericsson, the net sales contribution metric. But in accounting for only 6% of its global net sales in Q2, 2024, versus 14% in Q2, 2023.

India accounts for 75% of Nokia's 18% YoY sales decline

"Our preliminary investigations show that one of the self-owned multisig smart contract wallets created out of the Liminal ecosystem has been compromised," the company said in a statement. "We can confirm that Liminal's form is not breached. Liminal's infrastructure, wallets and sets continue to remain safe." To contain the panic, market peers including CoinDCX and Mudrex have a duty issued advisories that investors' money is safe in their wallets. "In light of the recent WazirX breach, we want to reassure all CoinDCX users that your assets are safe and not impacted in any manner. Our wallet security remains robust," co-founder and CEO Nit Gupta wrote in a post on X.

WazirX Loses \$203m in Biggest Cyberattack on Crypto Exchange

Blockchain experts suspect N Korean-govt backed Lazarus behind attack

Our Bureau

Mumbai: Cryptocurrency platform WazirX has suffered the largest cyberattack on an Indian exchange, mopping away \$203 million worth of investor holdings, which is nearly 50% of the platform's reserves.

Blockchain experts have discovered traces of North Korean government backed cybercriminal group Lazarus behind the attack. Lazarus is popular for having carried out world's largest crypto exchange attacks in the past where the attacked party was not able to recover the funds because the attackers do not engage in negotiations.

"Some preliminary investigations by researchers suggest the Lazarus group was behind the attack," Aditya Singh, crypto watcher and influencer told ET. "If that's true, the bad news is they do not cooperate, will never be held legally accountable, and are efficient with laundering."

He added that Lazarus has attacked exchanges and crypto mining marketplaces such as Bitbumb, Youbit and Nicehash in the past. Youbit filed for bank-



ruptcy after 17% of its assets were stolen. "The freeze on 50% of WazirX's assets is a pretty serious situation," Singh said. Market watchers believe the incident has the potential to ignite a ripple effect for the entire Indian crypto industry, which had just begun to resurge from a long winter. "We're aware that one of our multisig wallets has experienced a security breach," the company said in a statement. "Our team is actively investigating the

Jio Wired Broadband User Base Up 34.5% in a Yr, Airtel's 24.2%

Kolkata: Rising appetite for 5G-based fixed wireless access (FWA) services is pushing wired broadband growth in India, with Reliance Jio outpacing its closest rival Bharti Airtel.

Between May 2023 and May 2024, Jio's wired broadband user base jumped 34.5% versus Bharti Airtel's 24.2%, latest telco subscriber data collated by the regulator showed. As of end of May, Jio's wired broadband user base stood at 12 million compared to Airtel's 8 million.

Analysts say 5G-based FWA services may be seeing traction, which could break the monotonous logjam and open new revenue streams for India's telcos. A key reason for this is month-

ly average revenue per user (ARPU) from the 5G-based FWA business is seen to be at least three-times higher (at ₹600) than 5G mobile ARPU.

In the near-term, India's telcos may be starting at a potential target audience of around 100 million homes as the fixed broadband market remains grossly underpenetrated, analysts said. India's wired broadband user base is a modest 41.3 million as of May end, as per Telecom Regulatory Authority of India's data. "FWA is likely driving higher wired broadband user penetration logjam and open new revenue streams for India's telcos. A key reason for this is month-

ly average revenue per user (ARPU) from the 5G-based FWA business is seen to be at least three-times higher (at ₹600) than 5G mobile ARPU.

सं. 1996] नई दिल्ली, बुधवार, मई 24, 2024/ मेष 3, 1946
No. 1996] NEW DELHI, FRIDAY, MAY 24, 2024/JYAISHTHA 3, 1946

भारत का राजपत्र
The Gazette of India

सं.जी.सी.एल.-आ- 27052024-254379
CG-DL-E-27052024-254379

असाधारण
EXTRAORDINARY
भाग II-खण्ड 3-उप-खण्ड (II)
PART II - Section 3 - Sub-section (ii)
प्राधिकार से प्रकाशित
PUBLISHED BY AUTHORITY

सं. 1996] नई दिल्ली, बुधवार, मई 24, 2024/ मेष 3, 1946
No. 1996] NEW DELHI, FRIDAY, MAY 24, 2024/JYAISHTHA 3, 1946

MINISTRY OF ROAD TRANSPORT AND HIGHWAYS
NOTIFICATION
New Delhi, the 24th May, 2024

S.O. 2095 (E)—In exercise of powers conferred by sub-section (1) of section 3A of the National Highways Act, 1956 (48 of 1956) (hereinafter referred to as the said Act), the Central Government, after being satisfied that for the public purpose, the land, the brief description of which is given in the Schedule below, is required for construction of additional structure / bridges (widening), maintenance, management and operation of NH48 in the stretch of land from Km. 230.680 to Km. 250.000 in Taluka Mangrol & Kamrej, District Surat in the state of GUJARAT, hereby declares its intention to acquire such land.

Any person interested in the said land may, within twenty-one days from the date of publication of this notification in the Official Gazette, object to the use of such land for the aforesaid purpose under sub-section (1) of section 3C of the said Act.

Every such objection shall be made to the Competent Authority, namely, S.A.L.O. Br-1, A-Block, 4th Floor, Bahubali Building, Nangura, Surat in writing and shall set out the grounds thereof and the Competent Authority shall give the objector an opportunity of being heard, either in person or by a legal practitioner, and may, after hearing all such objections and after making such further enquiry, if any, as the Competent Authority thinks necessary, by order, either allow or disallow the objections.

Any order made by the Competent Authority under sub-section (2) of section 3C of the said Act shall be final.

The land plans and other details of the land to be acquired under this notification are available and can be inspected by the interested person at the aforesaid office of the Competent Authority.

SCHEDULE

Brief Description of the land to be acquired with or without structures falling NH48 in the stretch of land from Km. 230.680 to Km. 250.000 in Taluka Mangrol & Kamrej, District Surat in the state of GUJARAT

District : Surat
https://regazette.gov.in
Publication date: 24.05.2024
https://morthgov.in

GOPAL SNACKS LIMITED

(Formerly known as Gopal Snacks Private Limited)

Registered Office: Plot No. G2322, G2323 & G2324, GIDC, Metoda, Tal.:Lodhika, Dist: Rajkot, Gujarat, India | Tel.No.: +912827297060 | E-mail: cs@gopalsnacks.com
Web: www.gopalamnkeen.com | CIN: U16400GJ2009PLC058781

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30th JUNE 2024

Sr. No.	Particular	Quarter Ended			
		30 th June 2024		31 st March 2024	
		Unaudited	Audited	Unaudited	Audited
01	Total Income	3561.71	3601.45	3189.65	14069.08
02	Net Profit before tax	330.01	302.68	387.61	1317.96
03	Net Profit after tax	243.00	261.10	283.59	995.68
04	Total Comprehensive Income for the period [comprising Profit for the period (after tax) and other comprehensive income (after tax)]	241.84	263.32	281.42	993.88
05	Paid up Equity Share Capital (Face Value of ₹01/- per share)	124.60	124.60	124.60	124.64
06	Other equity	-	-	-	3779.04
07	Earnings per Share (of ₹ 01/- each) (not annualised)				
	a. Basic (₹)	1.95	2.10	2.28	7.99
	b. Diluted (₹)	1.95	2.10	2.28	7.99

Notes:

- The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Other Disclosures Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the stock exchange websites (www.seindia.com and www.seindia.com) and Company's website (www.gopalamnkeen.com).
- The aforesaid Financial Results for the quarter ended have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 18th July 2024.
- The limited review as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Other Disclosures Requirements) Regulations, 2015 has been completed by the auditors of the company.

Place: Rajkot
Date: July 18th, 2024

For: GOPAL SNACKS LIMITED
Sd/-
Bipinbhai Vithalbhai Hadvani
Chairman and Managing Director
DIN: 02858118



